

RELIEVING OFFICER

માર્ગ સંભળણ અમિકારી

(FOR USE IN AUDIT OFFICE)
(અનુકૂલ કાઢેલા બિપદોગ શરૂ)Entered in A/R
ફિલોગ/ફિલોગમાં લોંઘ કરીEntered in L/Acc
એચ/ફિલોગમાં લોંઘ કરીEntered in H/S
સેવા પત્રકમાં લોંઘ કરીJoining time admissible
મળવાપાત્ર કાયદે અધ્યાત્મ સમયJoining time taken
મળવાપાત્ર કાયદે અધ્યાત્મ સમયPay Slip issued
પાય રૂપિયાની કાર્ડAuditor
ઓડિટરA. A. G.
A. A. O.માર્ગ સંભળણ અમિકારી
ફિલોગ અમિકારી

5. Name and Initials (Block Letters)
.....
6. (i) નામ અને ગુંડી શરી (મોટ સંપત્તિ)
6. (ii) Whether returning or leave
.....
6. (a) જે સાથે પરદી પાત્ર છુટી હૈ ?
(i) If so, place at what orders of posting were received
.....
(ii) લોંઘ કોણ તો નિમલુણાનો કૃદુમ માયારૂ લેવા
(iii) If not, from what
.....
6. (b) જે સાથે પરદી પાત્ર ઉદ્દેશ કરેલા તો -
(a) Post
(b) કાંઈ કાંઈ પરદી અને
(c) transferred.
(d) નવી જાતની જાહેરી હતી હૈ ?
.....
6. (c) Date of relief at old station
.....
E.N.
A.N.
(e) કૃદુમ માયારૂ હતી હાજરી
સારીએ
સારી
7. Signature
.....
8. If only holding charge in addition to other duty.
c. જે વીજી કાર્ય ઉપદેશ હોય તો આજીની કોણ
(a) Official designation of relieving office
(b) માર્ગ સંભળણ અમિકારીની લક્ષ્યારી તોંક
(b) Name of Officer Posted, if known
.....
(c) નિમાલોં અમિકારીનું નામ કે આજી કોણ હૈ

Note :—A copy of this charge report has been send to this Treasury Officer Date
 નોંધ, - જો માર્ગ સંભળણ અમિકારી અને તેણેની અમિકારીને એ. એ રોજ રૂપાણ કરી છે.

(G.P.V.)—1084—5,000-Bks-12-2007.
 G.L., D.D., PST No. 4256/112036/B of 24-7-56
 and PST 4256/136891/E-7-12-56]
 એ. પિ. એ. ની. ની. પીલોસ્ટી/પણે/૧૯૭૦૩૬-૫, એ. પા-૧૦-૫૬,
 અને એ. પીલોસ્ટી/પણે/૧૯૭૮૭-૫, એ. પા-૧૨-૫૬ |

Gen. 93 e. g. R. (Revised)
 એ. એ. એ. એ. એ. (સુધીએ)

CERTIFICATE OF TRANSFER OF CHARGE

સર્વોચ્ચ પાત્ર કરી

Head quarters Date Forenoon / Afternoon
 સર્વોચ્ચ પાત્ર દિન/શાયાર રાત્ર / રાજી

Post પાત્ર

નામ નામ

Order under which transfer of charge made
 એ. પા-૧૦-૫૬ નામના લોચ દ્વારા

Permanant Advance made over Rs.
 રૂ. જા કાલમાં પ્રથમ રૂપાણ કરેલા હૈ.

RELIEVED OFFICER

સાર્વ સૌધાર અધિકારી

(FOR USE IN AUDIT OFFICE)
 (અધિકાર કષેત્રના ઉપયોગ આન્ડ)

Entered in A/R એન્ડર/એન્ડરાન્ડ

Entered in L/Acc એલી/એન્ડરાન્ડ નામ કરી

Entered in H/S એન્ડર/એન્ડરાન્ડ નામ કરી

Leave Salary issued
 Certificate એન્ડર/એન્ડરાન્ડ

અધિકાર એન્ડર/એન્ડરાન્ડ

Auditor એન્ડર/એન્ડરાન્ડ

A.A.G.
A.A.O.

નીચેનીએ લોકાન્ડેલ અનેદા
 (નિસારી અધિકારી)

- (1) Name and Initials (Block Letters)
 (એ) નામ અને દુષ્ટી લાભ (મોડા લાભ)
- (2) (i) If proceeding on leave
 (એ) એ પર જાય તો -
 (a) Duration of leave
 (એ) દાખાની મુલ્ય
 (b) Address during leave
 (એ) જાણ દરમિયાન સાથેનાથ
 (c) Place at which leave salary is to be drawn
 (એ) જાણ પાછ જાણાની લોચ દ્વારા
 (ii) If retiring if proceeding on leave preparatory to retirement and if it is proposed to draw the Provident Fund money immediately whether the application for withdrawal of Provident Fund money has been sent to the A.G.
 (એ) એ અનુષ્ઠાન કરી દ્વારા નિર્ધારિત રેટાની રૂએ પર જાય તો એ અને એ પ્રોવિફન્ડ કર્કણ નામની દ્વારા ઉપાડવાનું વિશેષાર્થી તોથી
 એ પ્રોવિફન્દ કર્કણ નામની ઉપાડવા માટેની અનુષ્ઠાન દોષમાંના
 અનુષ્ઠાન મોકલવાના આપી છે ક નથી.
- OR
 એન્ડર/એન્ડરાન્ડ
- (iii) If on transfer
 (એ) એ અનુષ્ઠાન કરી એન્ડ તો, એ અને એન્ડની એન્ડ તોથી -
 (a) Post and
 (એ) એન્ડ અને
 (b) Station to which transferred
 (એ) નામની
- Signature
 એન્ડ
- Official designation if only holding charge in addition to other duty
 એ અન્ને કર્યા ઉપરોક્ત માત્ર સાર્વ સૌધાર તોથી તોનો શરૂઆતી
 એન્ડ